

Joint Press Release of the 6th Deputy National Security Adviser Level Meeting of the Colombo Security Conclave

કોલંબો સીક્યુરિટી કોન્ફલેવની 6ઠી ઉપ રાષ્ટ્રયિ સુરક્ષા સલાહકાર સૂતરની મીટિંગનું જોઈન્ટ પ્રેસ રીલીઝ

07 જુલાઈ, 2022

ભારત, માલદિવ્સ, મોરેશિયસ અને શ્રીલંકા સમાવતા કોલંબો સીક્યુરિટી કોન્ફલેવનાં સભ્ય રાષ્ટ્રોએ ભારતનાં રાષ્ટ્રયિ સુરક્ષા પરિષદ સચિવાલય દ્વારા 7 જુલાઈ 2022 નાં રોજ કોચીમાં આયોજીત કરવામાં આવેલ 6ઠી ઉપ રાષ્ટ્રયિ સુરક્ષા સલાહકાર સૂતરની મીટિંગનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. બાંગ્લાદેશ અને સેશેલ્સનાં પ્રતનિધિ મંડળોએ નરીક્ષકો તરીકે ભાગ લીધો હતો.

ભારત ગણરાજ્યનાં ઉપ રાષ્ટ્રયિ સુરક્ષા સલાહકાર મહામહમિ શ્રી વક્રિમ મસિરી, માલદિવ્સ ગણરાજ્યનાં વદિશ સચિ મહામહમિ શ્રી અહમદ લતીફ, મોરેશિયસ ગણરાજ્યનાં વડાપ્રધાનની કચેરીનાં સુરક્ષા બાબતોનાં પ્રમુખ સંકલનકરતા મહામહમિ શ્રી યોધિષ્ઠિર ઠેકા અને શ્રીલંકા લોકતાંત્રિક સમાજવાદી ગણરાજ્યનાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ શાવેનદ્રા સલ્વિવા, WWV, RWP, RSP, VSV, USP, ndc, psc, MPhil, દ્વારા તેઓનાં સંબંધિત પ્રતનિધિ મંડળોની આગેવાની કરવામાં આવી હતી. શ્રીલંકાનાં કોલંબો સ્થિત CSC સચિવાલયનું પ્રતનિધિત્વ શ્રીલંકન નૌસેનાનાં નૌ વદિશ સહકારનાં નરિદેશક અને નૌ કામગીરીઓનાં નરિદેશક કાર્યકારી સચિ કપ્તાન મહામહમિ નશિાંથ પેઈરસિ, RSP, USP, દ્વારા કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશનાં પ્રતનિધિ મંડળની આગેવાની બાંગ્લાદેશનાં સશસ્ત્ર સેના વભિાગનાં પ્રમુખ સુરક્ષા અધિકારી લેફ્ટ. જનરલ વકાર ઉઝ ઝમાન, SGP, psc, દ્વારા કરવામાં આવી હતી જ્યારે સેશેલ્સનું પ્રતનિધિત્વ સેશેલ્સ રક્ષા બળોનાં ચીફ ઓફ સ્ટાફ મહામહમિ સમિોન અરુકાંગે દ્વારા કરવામાં આવ્યું હતું.

સહભાગીઓએ નીચેના પાંચ સૂતંબો પર 2022-23 માટેનાં સહકાર માટેનાં રોડમેપ અને 9-10 માર્ચ 2022 નાં રોજ કોલંબો સીક્યુરિટી કોન્ફલેવની 5મી રાષ્ટ્રયિ સુરક્ષા સલાહકાર સૂતરની મીટિંગ મીટિંગ પર લેવામાં આવેલા નરિણયોનાં અમલીકરણની ચર્યા કરી હતી:

- મેરટાઈમ સુરક્ષા અને સલામતી
- આતંકવાદ અને ઉદ્દામવાદનો સામનો કરવો
- ટ્રાફિકિંગ અને ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનો સામનો કરવો
- સાયબર સુરક્ષા, ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીનું સંરક્ષણ
- માનવીય સહાયતા અને આફત રાહત

નવી દલિહી

07 જુલાઈ, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.